

ચાઈલ્ડ કેર / શાળાએ પરત ફરવું - પુષ્ટિ પત્રક

માત્ર એક જ ખાનામાં નિશાની કરીને એ પુષ્ટિ કરો કે તમારું બાળક ચાઈલ્ડ કેર/શાળાએ પરત ફરવા માટે સમર્થ છે. આ પત્રક પર સહી કરીને, તમે એ ખાતરી આપો છો કે આ માહિતી ખરી છે.

વિદ્યાર્થીનું નામ: _____

મારું બાળક બીમાર હતું:

- મારા બાળકની PCR પરીક્ષણનો ઉપયોગ કરીને ફરેલી તપાસ નકારાત્મક આવી હતી અને તેના લક્ષણોમાં 24 કલાક (ઊંબકાં, ઊલટી, ઝાડા માટે 48 કલાક)થી વધુ સમયથી સુધારો થઈ રહ્યો છે. નોંધ: રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ વડે તપાસ નકારાત્મક આવવી બાળક/વિદ્યાર્થીનું ચાઈલ્ડ કેર/શાળામાં પરત ફરવા માટે મુક્ત નથી કરતું.
- મારા બાળકનું કોવિડ-19 માટે પરીક્ષણ નથી કરાયું પરંતુ તેણે લક્ષણ(ણો) શરુ થયા ત્યારથી 10 દિવસનો સેલ્ફ-આઈસોલેશન સમયગાળો પૂર્ણ કર્યો છે. મારા બાળકને તાવ નથી (દવાના ઉપયોગ વિના) અને તેના લક્ષણોમાં ઓછામાં ઓછા 24 કલાક (ઊંબકાં, ઊલટી, ઝાડા માટે 48 કલાક)થી સુધારો થઈ રહ્યો છે.
- મારા બાળકની PCR પરીક્ષણનો ઉપયોગ કરીને ફરેલી તપાસ સકારાત્મક આવી હતી અને તેણે લક્ષણ(ણો) શરુ થયા (અથવા પરીક્ષણ કરવામાં આવ્યું) ત્યારથી લઈને 10 દિવસનું સેલ્ફ-આઈસોલેશન પૂર્ણ કર્યું છે. મારા બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયું ન હતું. મારા બાળકને તાવ નથી (દવાના ઉપયોગ વિના), અને તેના લક્ષણોમાં સુધારો થઈ રહ્યો છે.
- એક સ્વાસ્થ્ય કાળજી પ્રદાતાએ પુષ્ટિ કરી છે કે મારા બાળકને કોવિડ-19 નથી અને તેને એક એવી સ્થિતિનું નિદાન કરાયું છે જે કોવિડ-19 સાથે સંબંધિત નથી. તેના લક્ષણોમાં 24 કલાકથી વધુ સમય (ઊંબકાં, ઊલટી, ઝાડા માટે 48 કલાક)થી સુધારો થઈ રહ્યો છે.
- મારું બાળક અન્ય કારણોસર ચાઈલ્ડ કેર/શાળા ખાતે ન હતું. મારું બાળક બીમાર નથી અને તે શ્વસનતંત્રના ચેપના લક્ષણો સહિતના કોઈ માંદગીના લક્ષણો નથી ધરાવતું.

મારા ઘરમાંની કોઈ વ્યક્તિ (દા.ત. માતા-પિતા, ભાઈ-બહેન) કોવિડ-19ના લક્ષણો સાથે બીમાર હતું:

- PCR પરીક્ષણનો ઉપયોગ કરીને ઘરના સભ્યની કોવિડ-19 તપાસ નકારાત્મક આવી છે, અને મારું બાળક (ઉપર નામ જણાવેલ) હવે ચાઈલ્ડ કેર/શાળાએ પરત ફરી શકે છે.

- ઘરના સભ્ય અંગે એક સ્વાસ્થ્ય કાળજી પ્રદાતાએ પુષ્ટિ કરી છે કે તેમને કોવિડ-19 નથી અને તેમને એક એવી સ્થિતિનું નિદાન થયું છે જે કોવિડ-19 સાથે સંબંધિત નથી. તેમના લક્ષણોમાં 24 કલાકથી વધુ સમયથી સુધારો થઈ રહ્યો છે. મારું બાળક (ઉપર નામ જણાવેલ) હવે ચાઈલ્ડ કેર/શાળાએ પરત ફરી શકે છે.
- ઘરના કોઈ સભ્યએ કોવિડ-19 માટે પરીક્ષણ કરાવ્યું ન હતું, પરંતુ મારા બાળકે (ઉપર નામ જણાવેલ) 10 દિવસનું સેલ્ફ-આઈસોલેશન પૂર્ણ કર્યું છે. મારું બાળક સ્વસ્થ છે અને કોઈ લક્ષણો નથી.

કોવિડ-19 માટે પરીક્ષણ સકારાત્મક આવ્યું હોય તેવા કોઈ વ્યક્તિનો ઘનિષ્ટ સંપર્ક:

- મારું બાળક એવી કોઈ વ્યક્તિના ઘનિષ્ટ સંપર્કમાં આવ્યું હતું જેમનું કોવિડ-19 માટે પરીક્ષણ સકારાત્મક આવ્યું હતું અને તેણે 10 દિવસનું સેલ્ફ-આઈસોલેશન પૂર્ણ કર્યું છે. મારું બાળક સ્વસ્થ છે અને કોઈ લક્ષણો નથી.
- મારું બાળક એવી કોઈ વ્યક્તિના ઘનિષ્ટ સંપર્કમાં આવ્યું હતું જેમનું કોવિડ-19 માટે પરીક્ષણ સકારાત્મક આવ્યું હતું. મારું બાળકનું પૂર્ણ રીતે રસીકરણ કરાયેલું છે*. મારું બાળક સ્વસ્થ છે અને કોઈ લક્ષણો નથી.
- મારું બાળક એવી કોઈ વ્યક્તિના ઘનિષ્ટ સંપર્કમાં આવ્યું હતું જેમનું કોવિડ-19 માટે પરીક્ષણ સકારાત્મક આવ્યું હતું. પાછલા 90 દિવસોમાં મારા બાળકનું કોવિડ-19 પરીક્ષણ સકારાત્મક આવ્યું હતું અને તેને જાહેર સ્વાસ્થ્ય દ્વારા મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. મારું બાળક સ્વસ્થ છે અને કોઈ લક્ષણો નથી.

તાજેતરમાં કેનેડાની બહાર પ્રવાસ:

- મારું બાળક કેનેડાની બહાર પ્રવાસ કરીને પરત ફર્યું છે. મારું બાળક 14 દિવસના પ્રવાસ ક્વોરન્ટાઈન સમયગાળા માટે ઘરે રહ્યું છે અને જો જરૂરી હોય તો પરીક્ષણ પૂર્ણ કર્યું છે. મારું બાળક સ્વસ્થ છે અને કોઈ લક્ષણો નથી.
- મારું બાળક કેનેડાની બહાર પ્રવાસ કરીને ઘરે પરત ફર્યું છે. મારા બાળકનું કેનેડામાં પોતાના પરત પ્રવેશ પહેલાં પૂર્ણ રીતે રસીકરણ* થયું છે અને જો જરૂરી હોય તો તેણે પરીક્ષણ પૂર્ણ કર્યું છે. મારું બાળક સ્વસ્થ છે અને કોઈ લક્ષણો નથી.

કોવિડ-19 પરીક્ષણની તારીખ (જો લાગુ પડે તો): _____ (દિવસ/ મહિનો/ વર્ષ)

હું જાહેર કરું છું કે મારું બાળક સ્વસ્થ છે, અને ચાઈલ્ડ કેર/શાળા પરત ફરવા માટે સમર્થ છે.

માતા-પિતા/વાલીનું નામ: _____

સહી: _____ તારીખ: _____ (દિવસ/ મહિનો/ વર્ષ)

*પૂર્ણ રીતે રસીકરણ થયેલ એટલે કોવિડ-19 રસી શ્રેણીની બીજી માત્રા લીધાના 14 કે તેથી વધુ દિવસો બાદ અથવા ઓન્ટારિઓ મિનિસ્ટ્રી ઑફ હેલ્થ દ્વારા વ્યાખ્યાયિત કર્યા અનુસાર.

પુર્ણ કરેલ પત્રકને ચાઈલ્ડ કેર/ડે કેમ્પ ઑપરેટરને અથવા બાળકની શાળાના પ્રિન્સિપાલને પરત કરશો.

કૃપા કરીને નોંધશો: આ પત્રકને સ્વીકારવાનું પસંદ કરવું અને તેનો ઉપયોગ કરવો કે કેમ તે નિર્ણય દરેક ઑપરેટર/શાળા/શાળા બોર્ડ પર આધાર રાખે છે.